

જનસંપર્ક અધિકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલીફોન નંબર ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૨/૦૪/૨૦૧૭ બુધવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૭૬૨/૧૭

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૫ કેસ કરી, ૩૭ વ્યક્તિઓને ઝડપી, ૨૬૨ લીટર દેશી દારૂ, ૬૧૬ બોટલ ઈંગ્લીશ દારૂ, ૨ ઓટોરિક્ષા અને ૨ કાર કબજે કરી હતી. તેમજ જુગાર ધારા હેઠળ ૨ કેસ કરી ૭ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૮,૧૮૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૭૬૩/૧૭

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૮૦ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૧૬ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપીડીની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૭૬૪/૧૭

મેઘાણીનગર: રામપ્યારે ઉમાકાંતસિંહ ઠાકુર (રહે.ગંગાનગર ગણેશ ચિક્કીની સામે દુર્ગા સ્કુલ પાસે ભાર્ગવ રોડ મેઘાણીનગર) એ તા.૧૧/૪/૨૦૧૭ નારોજ મેઘાણીનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૫/૯/૨૦૧૪ ક્લાક ૧૧/૦૦ વાગ્યાના સુમારે આરોપી (૧) રાજેન્દ્રકુમાર રુદ્રનારાયણ વ્રીવેદી (રહે. શિલ્પગ્રામ સોસાયટી વિહલેશ પેટ્રોલપંપની સામે નાના ચિલોડા) વેચાણ કરાર કરી રામપ્યારે ઠાકુર પાસેથી મેઘાણીનગર ગંગાનગર ભાર્ગવ રોડ કીના ઇલેક્ટ્રીકની દુકાન ખાતેથી ટ્રક નંબર જીજે ૧૮ યુ ૯૧૪૫ કિમત રૂપિયા ૧૧,૪૯,૦૦૦/- લઈ જઈ નાણા નહી ચુકવી વિશ્વાસઘાત અને છેતરપીડી કરી ટ્રક લઈ જઈ આરોપી (૨) રાજેન્દ્ર કુમાર મહેકુલાલ યાદવ (રહે.શ્યામનગર જશવંતનગર ધ્યાવાહ ઉત્તરપ્રદેશ)ને ફેરવવા આપી દીધી હતી. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી વાચ.પી.પટેલ ચલાવે છે.

ચોરી:-

સમાચાર યાદી નં.૭૬૫/૧૭

વટવા: રૂપાંતે વા/ઓ દિનેશચંદ્ર મોદી (ઉ.વ.૪૭) (રહે.સેક્ટર-૧૯ ગાંધીનગર) તા.૧૧/૪/૧૭ સવારના ૧૧/૦૦ વાગ્યાના સુમારે જતલપુર સ્વામિનારાયણ મંદિર ખાતે હનુમાનજીના મંદિર દર્શન કરવા ગયા હતા ત્યારે ભીડમાં રૂપાંતે મોદીની નજર ચુકવી અજાણી વ્યક્તિએ રૂપાંતે મોદીના પર્સમાંથી આઇફોન સેવન એસ મોબાઈલ ફોન કિમત રૂપિયા ૭૦,૦૦૦/- ચોરી કરી લીધો હતો. આ અંગેની ફરીયાદ રૂપાંતે મોદીએ વટવા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી કે.એસ.પટેલ ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૭૬૬/૧૭

શહેરકોટડા: (૧) ગીરીશ અંબાલાલ રોહીત (ઉ.વ.૨૫) (રહે.આંબેડકર લાઇન નંનર-૬ મેમ્કો નરોડા રોડ) એ બિમારીથી કંટાળી તા.૧૦/૪/૧૭ રાતના ૧૧/૦૦ વાગ્યા પહેલા મેમ્કો પુલ નીચે આવેલ આંગણવાડીની ઓરડીમાં પોતાની જાતે પોતાના બન્ને હાથ ઉપર બ્લેડ મારી આત્મહત્યા કરી હતી. આ અંગે શહેરકોટડા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી હમીરભાઈ અળસીભાઈ ચલાવે છે.

(૨) વિનયકુમાર રામવિલાસ રાહોડ (ઉ.વ.૨૪) (રહે. અનાર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની સામે અશોકમીલ પાસે નરોડા રોડ) એ અગમ્ય કારણસર તા.૧૦/૪/૧૭ રાતના ૧૦/૦૦ વાગ્યા પહેલા પોતાના ઘરે ઓસરીમાં સાડી બાંધી ગળેફાંસોખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે શહેરકોટડા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી દિલીપ એકનાથ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.